https://archive.org/details/bk1063/page/n0/mode/1up

All Items on https://archive.org/details/realpatidar

Full Library on https://realpatidar.com/library

ૐ

KJ-BK-4-21

શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ

શ્રી ખોંભડી ખાતે મૂર્તિ પ્રતીષ્ઠા કાર્યની મીનીટ

ખોંભડી તા. ૧૪-૫-૫૬

સવારના ૧૧ વાગાથી અત્રે મંદીર ના શણગાર કાર્યમાં અહીંના તમામ સનાતની ભાઈઓ રોકાયેલા હતા. આવનાર મહેમાનો તથા વોલીન્ટીયર ભાઈઓ માટે ઉતારાની સુંદર સગવડ રાખવામાં આવેલ હતી. ઉતારા માટે મકાન તેમજ વાસણો વીગેરે ની લોહાણા મહાજન ભાઈઓ તરફથી સુંદર સગવડ થયેલ હતી. અને તે બદલ સનાતની ભાઈઓ તેનો સહર્ષ ઉપકાર માનેલ છે. આજે સાંજ સુધીમાં વોલીન્ટીયર ભાઈઓ આવી ગયેલ હતા જેમાં નીચે મુજબ ગામોમાંથી ટુકડીઓની સંખ્યા આવેલ હતી. :-

વીરાણી	કોટડા	મથલ	રસલીયા	દેશલપર	ખોંભડી
૨૨	૧૪	૧૨	૫	૮	૨૦

આમ કુલ ૭૧ વોલીન્ટીયર ભાઈઓએ હાજરી આપેલ હતી. જેઓ જરાપણ ઢીલાઈ ન ગણતાં તરત કામમાં જોડાઈ ગયેલ હતા. આજે સાંજના ૭ વાગે અહીંના લધારામ ભીમજી ભાઈ નામના એક પાટીદાર ગ્રહસ્થ કે જેઓ મુંબઈ હતા તેઓ ત્યાંથી એરોપ્લેન મારફતે ભુજ અને ભુજથી સ્પેશીયલ કાર થી અત્રે આવી ગયેલ હતા અને તેઓની રજા મળતાં અહીંના લગભગ ૩૦૦ યુવકો કે જેઓ આજ સુધી અંદર પેટે સમાજમાં ભાગ લેતા હતા તેઓ જાહેરમાં આ કાર્યમાં જોડાઈ ગયેલ હતા. અને તેઓનાં ઓબીતા વર્તન ફેરવી તેમનાં પીરાણા પંથી પણીનો ઉશ્કેરાઈ ગયાં અને તેઓનો ભેગા અટકાવવા ઘણા ઉપાયો કર્યા પરંતુ સર્વે નિષ્ફળ ગયેલ હતા. આજે સાંજ સુધી. અત્રે ગામને નાકાં તથા ઠેકઠેકાણાં બોર્ડ તથા સામે મંડપ ઉપર ઉડાવતો સનાતની ધ્વજ ફરકાવી દેવામાં આવેલ હતો ગામમાં સનાતની ભાઈઓનાં કુલ ૭ સાત ઘર છે જેઓ આજ વીસ વરસથી ઉભા પીરાણા પંથીઓથી. જુદા બેઠા છે તેઓ સાથે ખાવા પીવા કે બીજો કોઈ પણ જાતનો વહેવાર નથી. છતાં પણ તે ભાઈઓ પાસેથી જાણવા મળેલ છે કે અહીંના ગામ ધણી જાડેજાઓ તથા લોહાણા મહાજન ભાઈઓ તેમજ અન્ય હિંદુ ભાઈઓ ની કૃપા વડે આ લોકોને જરા પણ મુંઝવણ આજ સુધી ઉત્પન્ન થયેલ નથી. અહીંના હિંદુ ભાઈઓનું સંગઠન અને શાંતિ ભર્યો ભાવ રાખ્યા વગર નું વર્તન ખરેખર આવકાર દાયક ગણાય.

સાંજે ૯ વાગે સમાજના પ્રમુખ શ્રી રતનશીભાઈ તથા બીજા ભાઈઓ વાડાસરી [illegible] આવી ગયેલ હતા.

ખોંભડી તા. ૧૫-૫-૫૬

આજે વહેલી સવારથી ગામના તમામ ભાઈઓ તથા બહારગામથી આવેલ સ્વયંસેવકો જુદે જુદે કામે લાગી ગયેલ હતા. ૧૦ વાગે સવારના નાકાં વીગેરે કાર્ય વ્યવસ્થીત કરી લીધેલ હતું સ્વયંસેવકોએ મંદિર ની અંદર હવન કુંડ તૈયાર કરી લીધેલ હતો. અને ૧૦॥ વાગે વાજતે ગાજતે જલ યાત્રા કરવા ગયેલ હતા. અને કેટલાક ભાઈઓ તો જુદાં જુદાં કામો

realpatidar.com

https://archive.org/details/bk1063/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v7.py

https://archive.org/details/bk1063/page/n2/mode/1up
-Khombhadi Laxminarayan Temple Inauguration (1063)
Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN, o=realpatidar.com, email=mail@realpatidar.com
Reason: I have reviewed this document
Date: 2026.02.20 17:28:31 +05'30'
Real Patidar Unravel Truth
realpatidar.com

ૐ

શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ

KJ-BK-4-21

શ્રી ખોંભડી પાન મૂર્તિ પ્રતીષ્ઠા કાર્યની મીનીટ

ખોંભડી તા. ૧૪-૫-૭૬

સવારના ૧૧ વાગાથી અત્રે મંદીર ના શણગાર કાર્યમાં અહીંના તમામ સનાતની ભાઈઓ ગુંથાએલા હતા. આવનાર મહેમાનો તથા વોલીન્ટીઅર ભાઈઓ માટે ખાવા ઉતરવાની સુંદર સગવડ રાખવામાં આવેલ હતી. ઉતારા માટે મકાન તેમજ વાસણો વીગેરે ની લોહાણા મહાજન ભાઈઓ તરફથી સુંદર સગવડ થયેલ હતી. અને તેથી સનાતની ભાઈઓ એનો સહર્ષ ઉપકાર માનેલ છે. આજે સાંજ સુધીમાં મળેલી વોલીન્ટીઅર ભાઈઓ આવી ગયેલ હતા જેમાં નીચે મુજબ ગામોમાંથી ટુકડીઓની સંખ્યા આવેલ હતી.:-

નીરોણી	કોટડા	મથલ	રસલીઆ	દેશલપર	ખોંભડી
૨૨	૧૪	૧૨	૫	૮	૨૦

આમ કુલ ૮૧ વોલીન્ટીઅર ભાઈઓએ હાજરી આપેલ હતી. જેઓ જરાપણ મુશ્કેલી વગરનાં તરત કામમાં જોડાઈ ગયેલ હતા. આજે સાંજના ૪ વાગે અહીંના લધારામ ભીમજી ભાઈ નામના એક પાટીદાર ગૃહસ્થ કે જેઓ મુંબઈ હતા તેઓ ત્યાંથી એરોપ્લેન મારફતે ભુજ અને ભુજથી સ્પેશીઅલ કાર થી અત્રે આવી ગયેલ હતા અને તેઓની રજા મળતાં અહીંના લગભગ ૩૦૦ યુવકો કે જેઓ આજ સુધી અંદર પેટે સમાજમાં ભાગ લેતા હતા તેઓ જાહેરમાં આ કાર્યમાં જોડાઈ ગયેલ હતા. અને તેઓનાં ઓળખીતા વર્તન ફેરવી તેમનાં પીરાણા પંથી પણીલો ઉશ્કેરાઈ ગયાં અને તેઓનો લોકો અટકાવવા ઉતાવળા થયા કર્યા પરંતુ સર્વે નિષ્ફળ ગયેલ હતા. આજે સાંજ સુધી અત્રે ગામને નાકું તથા ઠેક ઠેકાણાં બોર્ડો તથા સામા મંડપ ઉભાવતો સનાતની ધ્વજ ફરકાવી દેવામાં આવેલ હતો. ગામમાં સનાતની ભાઈઓનાં ફક્ત ૭ સાત ઘર છે જેઓ આજ વીસ વરસથી ઉજા પીરાણા પંથીઓથી જુદા ઉઠા છે તેઓ સાથે ખાવા પીવા કે બીજો કોઈ પણ જાતનો વહેવાર નથી. છતાં પણ તે ભાઈઓ પાસેથી જાણવા મળેલ છે કે અહીંના ગામ ધણી જાડેજાઓ તથા લોહાણા મહાજન ભાઈઓ તેમજ અન્ય હિંદુ ભાઈઓની ફોજ વડે અમોને જરા પણ મુશ્કેલી આજ સુધી ઉત્પન થયેલ નથી. અહીંના હિંદુ ભાઈઓનું સંગઠન અને ન્યાતભેદ ભાવ રાખ્યા વગરનું વર્તન ખરેખર આવકારદાયક ગણાય.

સાંજે ૯ વાગે સમાજના પ્રમુખ શ્રી રતનશીભાઈ તથા [illegible] ભાઈઓ [illegible] આવી ગયેલ હતા.

ખોંભડી તા. ૧૫-૫-૭૬

આજે વહેલી સવારથી ગામના તમામ ભાઈઓ તથા બહારગામથી આવેલ સ્વયંસેવકો જુદે જુદે કામે લાગી ગયેલ હતા. ૧૦ વાગે સવારના નાકા વીગેરે કાર્ય વ્યવસ્થીત કરી લીધેલ હતું સ્વયં સેવકોએ મંદિરની અંદર હવન કુંડ તૈયાર કરી લીધેલ હતો. અને ૧૦ાા વાગે વાજતે ગાજતે જળ યાત્રા કરવા ગયેલ હતા. અને કેટલાક ભાઈઓ તો જુદાં જુદાં કામો

https://archive.org/details/bk1063/page/n3/mode/1up
-Khombhadi Laxminarayan Temple Inauguration (1063)

KJ-BK-4-22

realpatidar.com

મંત્ર મંગલ ગાની રેકર્ડ ચાલુ કરી રહેલ હતા.

ૐ

જાહેર સભાનો રિપોર્ટ

તા.૧૫-૫-૭૭

શ્રી. મુળજીભાઈ પોકાણી ધાણા.

પૂ. મહારાજ શ્રી ભાઈઓ તથા માતાઓ.

સંત દયાલદાસજી મહારાજ

પાન મૂર્તિ = Photo

અમારા ગામમાં ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ પાન મૂર્તિ પ્રતીષ્ઠા કાર્ય માટે આપ સર્વે ભાઈઓને આમંત્રણ થી બોલાવેલ છે. અમારા ગામમાં પાટીદારોની વસ્તી ઘણી છે પરંતુ સનાતનમાં રહેલ કરનાર ભાઈઓ જુજ થોડા છે. તો અમારા આ કાર્યમાં આપ ઉદારથી આપનાર ભાઈઓની મદદની ખાસ જરૂર છે. અને મારા મતે જ્યારે અમારા કાર્યમાં ખામી જણાશે નહિ વસ્તુ આ ઉદાર તૈયાર છે પરંતુ તેનો ઉપયોગ કરનાર અમો જુજ થોડા ભાઈઓ છીએ તો મારી આપ સર્વે ભાઈઓ સમક્ષ વિનંતી છે કે અમારૂં આ કાર્ય તમારૂં પોતાનું સમજીને વધારી લઈ અમારા સમાજની શોભા વધારશો એમ આશા રાખું છું. આજની આ સભા શ્રીમાન રતનસીભાઈ સમાજના પ્રમુખની પ્રમુખતાથી કરવામાં આવેલ છે. પ્રમુખ આપણને બીજાં ઘણાં કાર્યો કરવાનાં હોવાથી તરતમાં સમેટી લેશું. એવી આશા રાખું છું.

શ્રી. રતનસીંભાઈ વીશાણી.

પૂ. મહારાજ શ્રી ભાઈઓ તથા બહેનો.

શ્રીયુત મુળજીભાઈએ આ ગામની જે પરીસ્થીતી વર્ણવી તે આપણે બધા સમજ્યા. ખોંભડી ગામમાં ગામમાં ઘણા દહાડીયા સનાતની ભાઈઓમાં ફકત સાતજ ઘર છે તેઓ આજ સુધી એક નીષ્ઠાથી ધર્મ કાર્ય કર્યે જાય છે જ્યારે આજે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની મૂર્તિ પધરાવવાનું ભાગ્ય પ્રાપ્ત કરી શકેલ છે. તો આ કાર્યમાં તન મન અને ધનથી સેવા આપવાની આપણી દરેક સનાતની ભાઈઓની ખાસ ફરજ છે. આપણે મહેમાન તરીકે આવેલ નથી. આપણું સ્વાગત આપણે પોતાનેજ કરવાનું છે તેમાં કોઈપણ પ્રકારનું કે માન અપમાન જોવાનું નથી. પરંતુ આપણું કાર્ય ૨૭ ધારે કર્યે જવાનું છે આ જેવું [illegible] આપણા સનાતની ભાઈઓ પધાર્યા છે તો તેઓની સગવડ સાચવવાની જવાબદારી આપણા શીર પર છે તે માટે કાર્ય કેમ આગળ [illegible] ગાડવામાં આવશે. અને આપણે સર્વે કાલી સેવાનો પુરતો લાભ લેશું એવી આશા રાખું છે. ત્યાર બાદ સ્વયંસેવકોની ફરજ શું છે તે વિષે સારામાં સારું વર્ણન કરી દરેક સ્વયંસેવક ભાઈઓને સમજાવેલ હતું.

અને તેઓ મુખ્ય કામની વેંચણી કરેલ હતી રસોડા વિભાગમાં.

3

KJ-BK-4-23

realpatidar.com

શ્રી. રસલીઆ ગોલ તથા દેશલપુરના વોલીન્ટીઅર ભાઈઓને નીમવામાં આવેલ હતા. તથા સભા આવનાર ભાઈઓની વ્યવસ્થા જાળવવાનું કાર્ય પણ તેઓને જ સોંપવામાં આવેલ હતું. સભા મંડપ તથા મંદીર ના કામ કાજ ખાતે શ્રી. કોટડા તથા વીરાણી ના વોલીન્ટીઅરો નીમાયેલ હતા. આવનાર ભાઈઓના ઉતારા વીગેરેની સગવડ કરવા ખોંભડી ના વોલીન્ટીઅરોને નીમવામાં આવેલ હતા. ઉપર પ્રમાણે બધા ભાઈઓને કાર્યની વેંચણી કરી દેવામાં આવેલ હતી. અને તે બધા ભાઈઓની મદદમાં શ્રી દેશલપુરના તથા રસલીઆના ભાઈઓ રોકાએલ હતા. આ પ્રમાણે બધાજ ભાઈઓએ પોતાનું કાર્ય સંભાળી લીધેલ હતું. ત્યાર બાદ સભા કાર્ય સમેટી લેવામાં આવેલ હતું અને કોટડાથી આવનાર મહેમાન નું સામૈયું તથા ભગવાનની મૂર્તિનાં ફુલેકાની તૈયારી આ કરવામાં આવેલ હતી.

સામૈયાનું વર્ણન.

મહેમાનો નું સામૈયું કરવા ગામમાંથી તમામ હિંદુ ભાઈઓ વાજતેગાજતે વધામણામાં ગયેલ હતા. જેમાં ગામના લોહાણા બ્રાહ્મણ ક્ષત્રિય વગેરે ભાઈઓની હાજરી હોઈ ગામના જુજ પાટીદારોની ગેરહાજરી કોઈને જણાએલ ન હોતી. સામૈયામાં આશરે ૩ થી સાડા ત્રણ હજાર માણસો ની સગવડ હતી. સરઘસ પાછું વળતાં બાનો પાસે આવતાં પાદરના પંથીઓ ભીંતો પરથી આ રમણિય દેખાવનું અવલોકન કરી રહેલ હતા. પરંતુ ~~સા~~ તેમાં હાજરી આપવાનું ભાગ્ય પ્રાપ્ત થઈ શકેલ ન હોતા. પધરાવતાં ભગવાન લક્ષ્મી નારાયણની પાન મૂર્તિ સાથે લઈ લેવામાં આવેલ હતી. આખા ગામમાં ફરી પાછા. સભા મંડપમાં આવતાં રા કલાક જેટલો સમય વ્યતીત થયો હતો

ૐ

ખોંભડીમાં પધારેલ જનરલ સભાનો તા. ૧૫-૫-૧૯૪૬.
રિપોર્ટ સમય- રાતના ૮ થી ૧।। સુધી.

realpatidar.com

પ્રમુખની દરખાસ્ત મુકનાર— શ્રી. મુળજી ભાઈ શીવજી ખોંભડી વાળા.
ટેકો આપનાર —: શ્રી. રતનસીભાઈ નારાણ. ,,
પ્રમુખ- શ્રી. મેઘજીભાઈ લાખુ મોથાળા વાળા.
પ્રમુખ —: પ્ર. મા. રા. શ્રી. ભાઈઓ તથા બહેનો
મને આજની સભાનો પ્રમુખ તરીકે જે પસંદ કરવામાં આવેલ છે તો હું મારી બુદ્ધિ અનુસાર તે સ્થાન સંભાળવાની સહાનુભુતિ બતાવું છું અને મારૂં સ્થાન સંભાળું છું.

KJ-BK-4-24

realpatidar.com

મારાજ દયાળદાસજી --- વાંઢાય વાળા.

નમોનમાર.

મેરબાન પ્રમુખ સાહેબ સજનો બ્રહ્મ સમાજ સદગૃહસ્થો અને બહેનો

આજની સભા જોઈ અતીશય હર્ષ થાય છે સનાતન ધર્મમાં આપણા બધા ભાઈઓ ભાગ લઈ રહ્યા છે તેથી આનંદ થાય છે ~~ન~~ પાટીદાર ભાઈઓના આ કાર્યમાં ઊમંગ કેટલીક વ્યક્તિઓ જાણે હિંદુઓ સર્વે ભાગ લઈ રહ્યા છે તે જોઈ આનંદ થાય છે. બંધુઓ આ સમય આપણી ફરજ અદા કરવાનો છે આજની સભામાં ઘણા ભાઈઓ બોલવાના છે જેથી હું મારું બોલવું ટૂંકમાં બોલી. મારો સમય સમાપ્ત કરીશ. આવતી કાલે આ ગામમાં ભગવાન શ્રી લક્ષ્મી નારાયણને આપણા મંદીરમાં પધરાવશું તો આપણા હૃદય મંદીરમાં પણ પધરાવવાના છે અને ત્યારે આપણે પ્રભુ પાસેથી શું માગશું ———— ભજન.

સાર—: પ્રભુ પાસે આપણને એજ માગવાનું છે કે જ્ઞાન આપો અને નિર્મળ બુધ્ધિ આપો શક્તિ નું દાન આપો. આપણા આ મંદીર નું કાર્ય કરતાં કરતાં શ્રી નારાણ ભાઈ શીવજી એ પોતાનો ભોગ આપ્યો અને તે કાર્ય આજે આપણે પૂર્ણ કરીએ છીએ ત્યારે તેઓના આત્માને કેટલો બધો આનંદ થતો હશે. આપણે આપણા ગામમાં પ્રભુને પધરાવી તેમાં પૂર્ણ શ્રદ્ધા રાખશું તો પ્રભુ આપણને પગે પગે સહાયતા આપવા માટે બંધાયેલા છે આજે કલીયુગમાં પણ પ્રભુ ભક્તોને સહાય થાય છે જેનો દાખલો ભજન-

ગાંધીજી જેવા મહાન આર્ય પુરૂષો આર્ય શબ્દ કંઈ નવીન નથી. આપણા બાપદાદાઓ એટલે કે હિંદુસ્તાનમાં મહારાણા પ્રતાપ-શીવાજી-રામ કૃષ્ણ હરિશ્ચંદ્ર મહાત્મા વગેરે થઈ ગયા તે ~~આર્ય~~ મહાત્માઓ જેવાને રાષ્ટ્રીય લડતમાં કેટલાં દુઃખો સહન કરવા પડે છે છતાં પણ પ્રભુ તેઓને પુરતી સહાય આપે છે. આપણે પણ દુઃખ સહન કરી પ્રભુમાં વિશ્વાસ રાખી કાર્ય કરશું જ્યું દુઃખથી ડરી જઈ પાછો ~~...~~ પગ ભરશો નહિ હવે પછી વધુ આપણા સમાજના પૈસી ડબ્બ કારતન સા ભાઈ સાવજબશી. ~~નાસી~~ રાજભાણામાં કંઈ ભૂલ થઈ હોય તો ક્ષમા આપીને બાળક ની તોતડી ભાષા પણ મીઠી લાગે છે તેમ ગ્રહણ કરી ક્ષમા કરશો. જૈન ને ધમાકેવા વધે આશીર્વાદનું દૃષ્ટાંત.

શ્રી મુળજી ભાઈ શીવજી - ખોંભડી વાળા.

મહારાજ શ્રીએ આજે ભજન બોલી આપણને જે ઉપદેશ કરેલ છે. તે આપણે બહુજ ટૂંક ભાગ લઈ રહ્યા છીએ તો આવતી કાલે તેઓના ઉપદેશનો લાભ લેવા પ્રોગ્રામ રાખવાનો વિચાર છે જે આપ સર્વ સમક્ષ મુકવું છું.

realpatidar.com

https://archive.org/details/bk1063/page/n6/mode/1up

KJ-BK-4-25

realpatidar.com

દેવશી કાનજી દેશપર

આજના પ્રભુના ઉત્સવમાં ઘણા ભાઈઓ પધારેલા જોઈ આનંદ વ્યક્ત કર્યો હતો એક માણસને પોતાની ખોવાઈ ગયેલી વહાલી વસ્તુ પાછી મળતાં જેટલો આનંદ થાય તેટલો જ આનંદ આજે આપણને આપણો ખોવાઈ ગયેલો સનાતન ધર્મ મળતાં થાય છે. આપણે હિંદુ વિષ્ણુ ભગવાનને માનનારા છીએ છતાં પણ આપણને આપણા ભગવાનમાં પુરતો વિશ્વાસ નથી. આપણે ઘણા ભગવાનોને માનીએ છીએ અને તેથીજ આપણને દુઃખો ભોગવવા પડે છે. જેમ મુસલમાનો એક ખુદા સિવાય કોઈને માનતા નથી તેમ આપણને પણ આપણા એક જ ઈષ્ટ દેવને માનવા જોઈએ. આપણે સનાતની ક્યારે કહેવાશું કે જ્યારે પ્રભુમાં સંપૂર્ણ વિશ્વાસ રાખીશું. અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરી દિવ્યજ્ઞાન રૂપી તેજસ્વી જ્યોત આપણા હૃદય મંદિરમાં પ્રગટાવવી જોઈએ. લડાઈ શુરવીરો રણે ચડે છે ત્યારે જે જુસ્સો દાખવે છે તેવો જ જુસ્સો ધર્મમાં દાખવી શકતા નથી તેવી જ રીતે આપણી જ્ઞાતિના ઘણા ભાઈઓ પરદેશથી સનાતન ધર્મ સ્વીકારવાની પ્રતિજ્ઞાઓ લઈને આવે છે અને જ્યારે કચ્છના કાંઠા ઉપર પગ મુકે છે ત્યારે તેના અંધ શ્રદ્ધાળુ વડીલોના દબાણથી દબાઈને પીરાણા પંથનેજ માને છે. અને બીજો ઉત્સાહ ઓસરી જાય છે એ ગનુ જ અઈસારા જેવું ગણાય આપણે દુનિયાના ધર્મોના છીએ તો આપણા વડીલોના આગમ ખાતર હારતો થાંભો વચનની ખાતર તેઓ શું કરી શક્યા છે તો આપણને પણ આપણી ટેક છોડવી જોઈએ નહિ. આપણે પરદેશ જતા હોઈએ ત્યારે આપણને કોઈ પુછે કે કોને માનો છો એટલે આપણે કહેશું કે બ્રહ્મા વિષ્ણુને માનીએ છીએ ત્યારે આપણને પુછશે કે ક્યો ધર્મ પાળો છો ત્યારે મહાન સવાલ ઉભો થાય છે અને આપણે આપણો ધર્મ બતાવી શકતા નથી. હવે આપણને સનાતન ધર્મ હાથ લાગી ગયેલ છે. એટલે જરા પણ મુંઝવણ જેવું રહેશે નહિ કોઈ પુછશે તો તરત કહેશું કે સનાતની છીએ. આપણે આથી આગાઉ કુંઈ વરતી ન હોતા ગયા પણ આપણે આપણા આચાર વિચાર છોડી દીધા હતા જેથી આપણને બીજા હિંદુ ભાઈઓ જુદી રીતેથી નીહાળતા જ્યારે આજે આપણે સર્વની હરોળમાં ઉભા રહી શકવાને શક્તી ભાન બન્યા છીએ. આજે આપણી વર્તણુંકમાં ફેર કરવાતાં બ્રાહ્મણ જેવા ઉંચ કોટીના માણસો પણ આપણી સાથે છૂટથી ભળે વહેવાર રાખતાં અચકાતાં નથી. પ્રત્યેક પ્રાણી પર દયા એ આપણું શુભ છે કરોડોનું દાન કરશું છતાં પણ જો આપણામાં દયા નહિ હોય તો એ દાનનો કંઈ પણ અર્થ નથી. માટે દયા રાખવી. હવે હું મારું બોલવું બંધ કરું છું

realpatidar.com

૬

KJ-BK-4-26

realpatidar.com

શ્રી. જેઠાભાઈ હરીભાઈ મેઘલ.

મારા સનાતની જ્ઞાતી ભાઈઓ પોતાના ધર્મમાં એકનીષ્ઠા રાખી જે કાર્ય કરી રહેલા છે તે માટે ખરેખર હું મગરૂર બનું છું અને હવે આખા ગુજરાતમાં પણ અમારી જ્ઞાતિ માટે અભિમાન કરી શકીશું કે મહારાજ શ્રી દયાલદાસજી જેવા જે મારા જ્ઞાતિ બંધુઓને ઉપદેશ આપી રહેલ છે તે હંમેશા આપતા રહે એવી તેઓ પ્રત્યે આશા રાખું છું. અંધ શ્રધાનું દ્રષ્ટાંત. આંધળાઓ ને ઓરવિપે પૈસા પકડાવવા બાબત.

આવીજ રીતે આપણા અંધ શ્રધાળુ થઈ લોકો પારાણા પૈસામાં શ્રધ્ધા રાખી સૈયદ રૂપી ઓરીઓએ હાથમાં પકડાવેલ પૈસા આ આપણી છાતીમાં મારે છે તો એ પૈસા મારનાર મારા અંધ શ્રધાળુ ભાઈઓને હું વિનંતી કરૂં છું કે આપણે રસ્તો ભુલી જઈએ ત્યારે ભોમીઆ માણસને પૂછવું કે ભાઈ મને રસ્તો બતાવ તેવીજ રીતે આપણે ધર્મ ભુલ્યા હોઈએ તો સુધારક ભાઈઓને પૂછવું કે અમને સાચો ધર્મ બતાવો તેમાં જે શરમ માનીઓ તો આપણે વધારે ઉંધે રસ્તે ચડી જઈએ અને પાછળથી પસ્તાવાનો વખત આવે એજ માટે બોલવું હવે વિરામ કરૂં છું.

માસ્તર મોતીલાલ રઘુરામ. કોદડા (ભેંકોર)

આજનો ઉત્સવ ખરેખર તો પાટીદાર ભાઈઓનો જ ગણાય છતાં પણ ગામના તમામ હિંદુ ભાઈઓ તેમાં ભાગ લઈ રહેલ છે તેનું કારણ એજ કે આપણે આપણે ભુલેલો માર્ગ છોડી દઈ પાછા સાચે માર્ગે તેઓના સમુદાયમાં ભડાઈએ છીએ તે માટે તે સર્વે ભાઈઓને પણ આભાર ઘટે છે જેમ આપણે ભગવાનના મંદીરને શણગારીએ છીએ તેવીજ રીતે આપણને આપણા હૃદય મંદીરને પણ શણગારવું જોઈએ એટલે કે આપણે આપણા આચાર વિચારમાં ફેર ફાર કરવા જોઈએ અને તે આપણા આચરણો ફેરવવાનો. બધા ધર્મ ધર્મ ઉપદેશકો અને કુમારીઓ ભાઈઓ છે તેઓ આપણને ઉપદેશ દ્વારા આપણા આચરણો ફેરવી શકશે. પાટીદાર સિવાય બાકીના બીજા હિંદુ ભાઈઓ ધર્મ કાર્યમાં સંપૂર્ણ સાથ આપી રહેલ છે તે બદલ આભારી થાઉં છું. તમારી જ્ઞાતિ એ ગંગા છે. એ ગંગા બરાબર સીધે માર્ગે વહ્યે જાય છે ફક્ત તેમાં ~~મ~~ વિધર્મી રૂપી કાદવ અને કુમશો છે તે કાઢી નાખવાની આપણી ફરજ છે. આટલું બોલી બેસી જવાની રજા માગું છું.

શ્રી. પુંજાભાઈ ખોલસી. ગવાલીઆર સ્ટેટ (અમરપુર)

આની પહેલાં જે ભાઈઓએ આપણને અમૃત રૂપી પાન કરાવ્યું કરી ગયેલ છે તે પ્રમાણે વર્તવાની આપણી બધાની ખાસ ફરજ છે. મારા બોલવામાં

realpatidar.com

KJ- BK- 4 - 27

realpatidar.com

કંઈ ખામી જણાવતો આપ સર્વે ક્ષમા કરશો. આપણા આ સુધારા કાર્યમાં યુવકોને ભાગ લેવાનો ખાસ આગ્રહ કરું છું કારણ કે દરેક સેવા કાર્ય યુવકો વડે જ થાય છે. આજથી ઓગણીસ વરસ ઉપર અમો કરાંચી મકાનમાં ઉપાસના કરતા હતા જ્યારે અમોને શ્રી. નારાણજી રામજી. રતનસી ખીમજી શીવજી કાનજી વગેરે સુધારક ભાઈઓએ ઉગારેલા હતા. સમજાવનાર ભાઈઓ તો આપણને સમજાવે પરંતુ આપણને તેઓનાં વાક્યો ગ્રહણ કરવા જોઈએ. શરીર ક્ષણ ભંગુર છે આપણા પર વિનાશીન કાળ ભમ્યા કરે છે તો આપણે આપણી જીંદગી માં સુકર્મો કરીશું તોજ આપણો ઉધ્ધાર થશે. આથી અગાઉ ઘણા ભાઈઓ ધર્મ ને માટે પોતાનાં રક્ત વહેવડાવી ગયેલ છે. તો આપણે પણ આપણા ચડી ગયેલ સનાતન ધર્મને પાછો ધારણ કરી આપણી ફરજ અદા કરશું એવી આશા રાખું છું. આથી અગાઉ આપણા ઘણા ભાઈઓ ધર્મ બાબત સુંદર ટીકા કરી ગયા છે એટલે તે બાબત વધારે સમય લેવા માગતો નથી. આપણા વડીલો કોણ હતા આપણા વડીલો મહાવીર રામચંદ્ર અને પ્રતાપ જેવા થઈ ગયેલ છે તો આપણે તેના સંતાનો છીએ એટલે. જે માર્ગે તેઓ ચાલી ગયા છે તેજ માર્ગ આપણને પણ ગ્રહણ કરવો જોઈએ. આપણે આપણો સનાતન ધર્મ સ્વીકારવો જોઈએ. અને તે ધર્મ સ્વીકારીને ખાલી ધર્મ ની વાતોજ કરવાની નથી. પણ આપણે તે ધર્મના સંજોગો અનુસાર આચરણ કરવું જોઈએ આપણા હરિશ્ચંદ્ર અને રામચંદ્ર જેવા થવાય તો પોતે જે માર્ગે ચાલી ગયા છે તેજ માર્ગે આપણને ચાલવાનું સુઝશે. હું ઘણા લાંબા સમય માં ગયાં વરસોથી બહાર રહું છું એટલે મને અહીંનો ખાસ અનુભવ નથી છતાં પણ વડીલ આના બોલવા પરથી અનુમાન કરી શકું છું કે અહીં યુવક વર્ગમાં જોઈએ તેવું જોર નથી યુવકોએ ખાસ સમજવું જોઈએ કે જ્ઞાતી નાવનું સુકાન યુવકોના હાથમાં છે. માટે એ નાવ ઉંધી દીશાએ ન ચડી જાય તેમાટે સુકાનીએ તો હર હમેશ જાગ્રતી માંજ રહેવું જોઈએ. આપણે આપણું વર્તન મધુમય રાખવું જોઈએ.

ત્યાર બાદ શાસ્ત્રોક્ત દાખલાઓ પ્રેમ કેવો હોવો જોઈએ વગેરે બાબતો સુંદર રીતે ચર્ચી હતી. ત્યાર બાદ કેળવણી વિષે પણ અસર કારક ચર્ચા કરેલ હતી. અને હિંદુઓનો ધર્મ શું છે તે સમજાવેલ હતું અને અજબા રાણા વિષે મહારાજ જયસીંહનું દ્રષ્ટાંત આપેલ હતું જેમાં નાત ધર્મનો પણ સમાવેશ થાય છે. તો આપણને પણ આપણો સનાતની ઝંડો સજીવ રાખવામાં ગમે તેટલાં સંકટો પડે તો પણ પાછા હઠવું નહિ આટલું બોલી બેસી જવાની રજા માગું છું કારણ કે હજુ મારા પછી ઘણા ભાઈઓને બોલવાનું છે.

અસ્તુ-

આ પછી શ્રી. શીવજી ભાઈ કાનજી નું ભાષણ રહી ગયેલ છે તે પાના માં લખેલ છે.

realpatidar.com

KJ-BK-4-28

realpatidar.com

શ્રી રતનસી ભાઈ ભીમજી પીરાણા પાટી. સમાજ – પ્રમુખ.

આથી આગાઉ બોલી ગયેલા ભાઈ બોલેલા વિદ્વાનોનો ઉધ્ધાર માનેલ હતો આપણી શાળામાં કેટલી બધી ખામીઓ દૂર થઈ ગઈ છે તે આપણે આજના મેળાવડા પરથી જાણી શકીએ છીએ. આપણે ઈ.સ. ૧૫૪૨ થી ૧૯૩૨ સુધી પીરાણા પંથને માનતા હતા પણ આચાર વિચાર વૈદીક ધર્મના પાળતા હતા. પરંતુ ૧૯૩૨ પછી ~~પરંતુ~~ વાળી ભાવાં સૈયદ વગે ગપરી શંકર ભટ થાણેરે નખત્રાણા નજીક કચ્છમાં આવ્યા અને ત્યારથી આપણા વર્તનમાં ફેરફાર થયો. ભાર ને આપણે માનતા હતા તેઓને પણ રજા આપી. સૈયદોનાં આક્રમણ આપણા ઘરમાં ઘુસેડી દીધાં અને આ પીરાણા પંથનાં પુસ્તકોમાં પણ અર્બી મુસલમાની શબ્દો અને આરબી હિંદુ શબ્દો ઘુસાડી દીધા પીરાણા પંથનાં ધર્મ પુસ્તકો અધીક હાથથી લખેલ હશે કોઈ પણ છાપેલાં હશે નહિ તેનું કારણ આવા અર્ધ દગ્ધ પંથનાં પુસ્તકો કોઈ પ્રેસ વાળા પણ છાપે નહિ. સૈયદોએ જો આપણા વડીલોને એમ સમજાવેલ હોત કે આ ધર્મ હિંદુ નથી તો આપણા વડીલો તેનો સ્વીકાર કરી પણ કરત નહિ પરંતુ તેમ ન સમજાવતાં ચાલાકી વાપરીને આપણા ધર્મમાં મુસલમીન તત્વો ઘુસેડી દીધાં. આજે કચ્છમાં સનાતની આલીસ હજાર છે તે બધા આપણી જ્ઞાતિ સાથે સભાઓમાં રીવાજોનું સામ્યતાન પધારી થયેલ છે. આપણામાં વિધર્મી તત્વો આટલા બધાં વરસો સુધી ટકી રહેવાનાં કારણો ઘણાં છે એક તો કચ્છમાં કંઈ પણ સાધનો નથી. નથી કેળવણીનાં કે નથી. નવીન સમાચારો જાણવાના. આવો પંથ પરદેશમાં એક છ માસ સુધી પણ ટકાવી શકાય નહિ કારણ કે ત્યાં આપણા જ ભાઈઓના વર્તન ની છાપ આપણા પર પડે પરંતુ અહીં તો આપણે આપણા ગુજરાત કાઠીયાવાડના પાટીદાર ભાઈઓથી જુદા પડી ગયા છીએ અને તેઓના સંસર્ગમાં આવી શક્યા નથી. એટલે જ આજ સુધી આપણા સાચા ધર્મને ઓળખી શક્યા નથી. મારા ઘણા ભાઈઓને એમ લાગે છે કે સુધારકો તો ધરમની નીંદા કરે છે પણ અમો એવા અભાગીઆ નથી કે ગંગા સ્વરૂપ આની નીંદા કરીએ પરંતુ માતા કુમાર્ગે જતી હોય તો તેને અટકાવી સુમાર્ગે ચાલવા મોકલવાનો કરવાનો પુત્રની ખાસ ફરજ છે. મારાથી આગાઉ ઘણા ભાઈઓ બોલી ગયા તેમ હું પણ કહું છું કે પીરાણા પંથ હિંદુ ધર્મ છે એમ કોઈ સાબીત કરી આપતું હોય તો હું તેનો જીંદગી ભરનો ગુલામ બનીશ અને જો તે હિંદુ નથી એમ અમો જાહેર કરી આપીએ તો સનાતની ઝંડાની ઓથમાં આવો. સૈયદો તરફથી પણ કહેવામાં આવેલ છે કે આમારી જેમ બને તેમ મુસલમાન સમુદાય વધારવાની ફરજ છે. અને અમોએ તમારી ભોળી કોમ પર અમલ કરી.

realpatidar.com

KJ-BK-4-29

realpatidar.com

આમારી ફરજ અદા કરીછે. ૨૫ મી તારીખે હિંદુ મહાસભાની સભા શ્રી. મુંજા મધ્યે ભરશે અને તેમાં હાજરી આપવાનું મને પણ આમંત્રણ છે. તેનાથી જનેતાના આશીર્વાદ કેવા હોય કે દીકરો ધર્મ યુધ્ધે જતો હોય તો આશીર્વાદ આપીને કહે કે બેટા માની કુખ ઉજાળજે જ્યારે આજ મારા બંધુઓ ધર્મ કાર્યમાં ભાગ લેવા જતાં એટલે જનેતાઓ તેને અટકાવવા માટે કુવે પડવા જાય છે. ધન્ય છે આવી જનેતાઓને. આમ થવાનું કારણ અજ્ઞાનતા. આપણને ઉપદેશકો મળ્યા નથી. આપણે કોઈના ઉપદેશો ગ્રહણ કર્યા નથી. તેથીજ આવા અજ્ઞાન વિચારો આપણને આવે છે. મારા અંધ શ્રધ્ધાળુ વડીલોને વિનંતી કરું છું કે એ તમારે ગોળી પીવાની તમારી ટેક કાયમ રાખવી હોય તો. તમારા ગામના તળાવેથી. માટી લાવી તેની ગોળીઓ બનાવી પીએ પરંતુ પીરાણાથી આવેલ અપવિત્ર ગોળીઓ કદાપી ન પીતા. સાંભળો ગોળીનું વર્ણન.

પીરાણામાં. સૈયદોના મઝાર કે પાંચ રોજા છે જેને જુદી જુદી જાતો. રબારી કંસારા ~~સૌ~~ કોળી વગેરે માને છે. આપણી જ્ઞાતિના પીરાણા પંથીઓ મૃતદેહને દફનાવે છે જ્યારે ત્યાંના પીરાણા પંથના અનુયાયીઓ મરનારના મૃતદેહને અગ્નીસંસ્કાર કરે છે. અને આપણે હિંદુ ભાઈઓ મરનાર માણસનાં ફુલ એટલે કે હાડકાં. પવિત્ર જળમાં પધરાવીએ છીએ તેવી રીતે ત્યાંના માણસો મરનારનાં હાડકાં પીરાણામાં ગંગવો કુવો છે તેમાં નાખે છે. આ ગંગવા કુવામાં ગોળી જેટલું પાણી રહે છે હવે. ત્યાં ઈમામશાહની કબર ઉપર ~~અંબ~~ સુખડ વગેરે વસ્તુઓનો લેપ કરે છે. અને ~~એ~~ લેપના પર કબર ઉપર બાઝે છે તે ઉતારી મારે. ગંગવા કુવાના પાણીથી ધોઈ ને ઉકાળવામાં આવે છે અને એ ધોયેલ કચરા માંથી. ગોળીઓ તૈયાર કરી કરંડમાં હરેક ગામે મોકલાવવામાં આવે છે. આ ગોળી આવી રીતે બને છે. તેમાં જરા પણ ખોટું છે એમ કોઈ કહેતું હોય. તો આ સભા સમક્ષ હાજર થાય અને પોતાનું સત્ય સીધ્ધ કરી બતાવે તો હું તેમનો ગુલામ બની જઉં.

Paval, How made?

ત્યારે બોલો મારા બંધુઓ આ ગોળી કેટલી અપવિત્ર ગણાય. અને તે આપણે પી અને દેહને ભ્રષ્ટ કરીએ આપણને પોતાને પણ આ વાત કેટલી શરમ જનક લાગે છે. તેમાં ઉચિત સમજુ લોકો હશે. મેં તો જ્ઞાતિ સેવાનો ભેખ લીધેલ છે. અને કદાચ જ્ઞાતિ સેવામાં અર્પણ એ મારું મૃત્યુ થશે તો પણ પ્રભુ પાસે હું એજ પ્રાર્થના કરીશ કે મને બીજો જન્મ પણ પવિત્ર પાટીદાર જ્ઞાતી માં આપે કે જેથી હું મારું અધુરું રહેલ સેવાકાર્ય પૂર્ણ કરી શકું. જ્ઞાતીની સેવા કરનાર કદીપણ રડુબા ~~થ~~ તો નથી — ગરૂડજીના અભિમાનથીએ દૃષ્ટાંત— ચીંથરીમાં હૈડાં ઘાલે

realpatidar.com

https://archive.org/details/bk1063/page/n11/mode/1up

KJ- BK-4-30

realpatidar.com

જ્ઞાતીને અન્યાયી હોય તો તેનો સામનો કરવાની આપણી ફરજ છે. પાંચ
પાંડવો વતી શ્રી કૃષ્ણ ભગવાને દુર્યોધનને તેઓનો ભાગ આપવા કેટલો સમ
જાવ્યો ~~ક~~ પરંતુ જ્યારે દુર્યોધને કહ્યું સોયની અણી જેટલી પણ જમીન પાંડ
વો માટે નથી ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને પાંડવોને યુધ્ધ કરવાનું કહ્યું અને
પોતે અર્જુનના મહારથી બન્યા. આપણી લડત સત્યની છે. અને પુંજભા
ઈના કહેવા પ્રમાણે દરેક યુવકોએ આ કાર્યમાં ઝુકાવવું જોઈએ. હવે મારે
શરીર પણ નબળું પડતું જાય છે એટલે મને આ કાર્યમાં યુવકોના સાથની ખાસ
જરૂર છે. આથી અગાઉ આપણામાં ઘણા જ્ઞાતી સુધારકો થઈ ગયા પણ તેઓના
નારીથી જ્ઞાતીને આવી સલાહો મારફતે સમજાવવામાં આવેલ નહોતું. આમા
રી પોતાની પણ કેટલીક ભુલો આજે અમોને સમજાય છે. શરૂઆતમાં અમો
એ પણ જ્ઞાતીને સમજાવવાને બદલે કેવળ તેઓની નીંદા જ કરેલ છે. કરણીઓ
જેમ પોતાના ગાળ બોલવાના કાર્યમાં નીશરમ થતા નથી. તેમ આપણે પણ
આપણા કાર્યમાં કંટાળવું જોઈએ નહિ. મારી બહેનોને ખાસ વિનંતી કરું છું
કે તમો પણ રૂપનું એક ફૈંડું છો મારા બંધુઓને તમારા સાથની પણ ખાસ જરૂર છે.
જે ઘરમાં અશાન્તતા અને અપવિત્રતા છે તે ઘર સ્મશાન રૂપ છે. કારણ કે ત્યાં
પ્રભુનો વાસ હોતો નથી. જો આપણને આપણા ઘરમાં પ્રભુ પધરાવવા હોય તો
આપણે નિતી અને ટેક નું પાલન કરવું જોઈએ. આપણી અજ્ઞાન જ્ઞાતીમાં
નારી સન્માન પણ નથી તો પુરૂષોને પણ ભલામણ કરું છું કે જ્યાં સુધી નારીઓ
નું સન્માન સમજાશે નહિ ત્યાં સુધી તેણીઓ આપણને પ્રભુ રૂપ ગણશે નહિ
અને જ્યાં સુધી આપણે પ્રભુ રૂપ ગણાશું નહિ ત્યાં સુધી આપણા ઘરમાં
પ્રભુનો વાસ પણ થશે નહિ. એક નારીનો પતી મરણ પથારીએ હોય ત્યાર
થી જ તેની સ્ત્રી ઘરમાંથી સારી સારી વસ્તુઓનો સંગ્રહ કરે છે. અને પતી ગુજરી
જતાં તે બીજાનું ઘર દીપાવવા નાતરે જવાની થઈ જાય છે ધન્ય છે આવી અબળા
ઓને. તેમ પુરૂષોની પણ કુરતા ઓછી નથી. એક બહેનનો પતી ગુજરી જાય
એટલે તરત તેણીનાં માવીત્રો બીજે ઠેકાણે આપવાનો સોદો કરી તેણીને ઉઠા
ડી જાય. સાસરાને ત્યાં આવે છે તેણીને બે ચાર બાળકો હોય છતાં પણ જ્ઞાતીની
ફરજ પાડે છે કદાચ તેણી કહે કે મારે પતીવ્રત પાળવું છે અને બીજે નથી
જવું તો બીસાં ભરૂ આગેવાનો નો બીજને આરકી ભડવાના ભયે તેઓ
તેણીનાં માવીત્રોને ઉંધું સમજાવે છે કે તમારી છોકરી વ્યભીચાર કરી તમારા ના
મને લાંછન લગાડશે. માટે બીજે ઠેકાણે ઘર કરાવો. એટલે તેણીનાં માવીત્રો
તેને બળ જબરીથી. ત્યાંથી પોતાને ઘેર લઈ જાય છે. જ્યારે તેણીનાં સાસરાં તરફ
થી. બાળકો લઈ લેવામાં આવે છે. ઓતે તેણીને બિચારું દુઃખ પડે છે અને.

realpatidar.com

https://archive.org/details/bk1063/page/n12/mode/1up

KJ- BK- 4-31

realpatidar.com

કહે છે કે મારાં બાળકો મને ન આપો તો ભલે અહીંજ રાખો પરંતુ મને
એક પખાળ તેને ઊભી ભરીને પીરસાવવા આપો તો પણ મને શાંતી થશે
પરંતુ રઢીયાળી બાળાઓ અને સાસરીઆઓ તેમ પણ કરવા આવતાં નથી અને
બીચારીને રડતી કકળતી લઈ જઈને બીજે ઠેકાણે પરણાવે છે. કેટલી બધી
અધમતા. આથી વધારે શું હોય. આપણા માં આપણી બધી નામના હોય તો
પછી નારીઓ કયાંથી માને કે પતી અમારા પરમેશ્વર છે. દ્રષ્ટાંત-બરકતપંથ
બાબત. બ્રાહ્મણ નાં કુટુંબનું-

આપણી પટલાઈ જ્ઞાતી માં ભુલોનો ગણો છે. પરંતુ જનરલ મીટીંગ માં એ ભુલો
ગણાવવાનું હું યોગ્ય માનતો નથી. આપણી જ્ઞાતી ને સત્સંગની પણ ખાસ.
જરૂર. આપણી સભા જેવી. સભા અગાઉ કોઈ પણ થયેલ નથી - કથા વાર્તાઓ
ના. સાંભળેલું ગ્રહણ કરવા જોઈએ. દ્રષ્ટાંત પતીને પ્રભુ તુલ્ય માનવા જો
ઈએ. આજ્ઞામાં રહેવા જોઈએ. બ્રહ્મચર્ય ગ્રહણ કરવા જોઈએ.
સંતાનો માં સંસ્કાર રેડવાનું કામ સ્ત્રીઓનું છે. તો મારી માતાઓ પોતાના બા
ળકો કે જે ભવિષ્યના નાગરીકો છે તેને સારું જ્ઞાન આપશે એવી વીનંતી કરૂં છું.
ત્યાર બાદ યુવક વર્ગને આપણા આ કાર્યમાં ઠીક નિસ્બત રાખવા બાબત ભ
લામણ કરેલ હતી. અને સમારે દાખલાઓ આપેલ હતા. પછી પોતા
ને સ્થાને બેસી ગયા હતા.

શ્રી. રણમલ માવજી ઉખરડા વાળા.

આવતી કાલે અમે શ્રી. ભગવાન લક્ષ્મી નારાયણ પાન મૂર્તિ ની.
પ્રતીષ્ઠા થાય છે. તેવીજ રીતે આજ થી. ૭ થી ૮ દિવસ પછી એટલે કે વૈશાખ
વદી ૭ અથવા ૮ ના રોજે અમારે અમારા ગામ ઉખરડામાં પણ પાન મૂર્તિની
પ્રતીષ્ઠા કરવાની છે તો. આપણા સમાજના ભાઈઓ જેમ અહી પધારેલ છે
તેમ. તે દહાડે અમારે ત્યાં પણ પધારી અમારા ગામની શોભા વધારશો એવી.
વીનંતી કરૂં છું

realpatidar.com

શ્રી. પુંજાભાઈ ખેતસી.

શાસ્ત્રોક્ત સમોર દાખલા આપેલ હતા તથા એક ગીત ગાય બતાવેલ હતું.

શ્રી. મુળજીભાઈ શીવજી ખોંભડીવાળા.

આવતી કાલે આપણે આપણું કાર્ય સવારમાં વહેલું.
શરૂ કરવું એવી. આપ સર્વે ભાઈઓ સમક્ષ દરખાસ્ત મુકું છું.
કારણ કે ભગવાન પધરાવવા નું મૂહુર્ત સવાર માં વહેલું છે

KJ-BK-4-32

realpatidar.com

શ્રી. શીવજી ભાઈ કાનજી પારસીઆ નખત્રાણા.

ખોંભડી જેવાં ગામમાં આવી જબરદસ્ત સભા થવા બદલ આનંદ વ્યક્ત કરેલ હતો કહેવત છે કે શીવાજી ન હોત તો હિંદુસ્તાનમાં હિંદુ નું નામ નિશાન પણ રહેત નહિ તેથીજ રીતે આપણી જ્ઞાતિમાં પણ આપણાજ વડીલો કે જેઓ સવારમાં ઉઠતાં વેંતજ અલ્લાનું નામ લેતા. તેઓ પણ આજે સમાજને તન મન અને ધનથી સેવા આપી રહ્યા છે મારા સનાતની ભાઈઓને વિનંતી છે કે આપણે આપણું ધર્મનું સ્થાન ઉંચા થી. આપણા આભરણોની ઉપજ પર છાપ પાડો મને ગણા ખુલ્લા પાસેથી જાણવા મળેલ છે કે અમોને અમારા માબિઓ તરફથી. ખુબ દબાણ કરવા માં આવે છે તો મારી માતાઓને મારી ખાસ વીનંતી છે કે તમો તમારા સંતાનોને કુમાર્ગે જતા જરૂર અટકાવો પરંતુ ધર્મ જેવા સારાં કાર્ય માં ભાગ લેતા હોય તો અટકાવો નહિ પરંતુ તેમાં ભ્યાની શુભકામના કરો. કે જેથી આપણા સનાતન ધર્મનો ફેલાવો કરે. મહારાણા રાજસિંહ નું દ્રષ્ટાંત માતા ધર્મનો સચોટ પુરાવો. ધર્મના સ્થાન નું નામ કદી બદલાવવામાં આવતું નથી જ્યારે આપણા પીરાણા પંથી ના દેવળ નું નામ અત્યારે ત્રીજું ચાલે છે. શરૂઆત માં ખાનું નામ હતું પછી જગ્યા નામ થયું અને હવે જ્યોતિર્ધામ થયું. કહો ત્યારે આપણને આપણા દેવળના નામ માં ફેર ફાર કરવાની શું જરૂર છે અને સમય અનુસાર નામની ફેર ફાર થાય છે તો પછી તેની અંદર ના વ્યવસ્થામાં પણ ફેર ફાર શા માટે ન હોય કોઈ એવા ગામ માં સનાતની ભાઈઓ થોડા છે. છતાં પણ પ્રભુ પોતાનાં કાર્ય પાર કરશે માટે આપણે આ કાર્ય નિડર પણે કરવું જોઈએ. આપણે સનાતની ઝંડો અમર રાખવા માં આપણ ને ગમે તેટલાં સંકટો પડે તો પણ સહન કરવાનો આપણો ધર્મ છે. આટલું બોલી બેસી જવાની રજા લઉં છું.

realpatidar.com

શ્રી. રતનશી ભીમજી ધોશાણી.

આપ સર્વે ભાઈઓને એક આનંદનો સમાચાર આપવાનો છે અને તે એજ કે આ ગામમાં ભગવાન ની મંદીર ની સ્થાપના કરનાર સ્વર્ગવાસી શ્રી યુત નારાણ ભાઈ શીવજી વાગડીઆ છે. તેઓએ મારી રૂબરૂ પ્રતીજ્ઞાઓ કરેલ કે મને મારા ગામ માં ભગવાનની મૂર્તિનું પ્રતીષ્ઠા કાર્ય મારા હાથેજ કરવું છે પરંતુ તે ભાઈની જીવન સફર ટુંકી હોતાં તેઓ

અલ્લાહનું/Allah

Changes in Names of Khanas

KJ- BK- 4 - 33

realpatidar.com

આ કાર્ય પોતાને હાથે કરી શકયા નથી. પરંતુ તેઓની પ્રતીજ્ઞા આપની કાલેજ આજે પુર્ણ કરવાના છીએ ત્યારે તેમના અમર આત્માને કેટલી શાંતી થશે. અને આ કાર્ય કરનાર ભાઈઓને તેઓ કેટલા ઉંચા શુભાશિર્વાદો આપશે. આજે આપની કાલે. પ્રતીષ્ઠા કાર્ય તેઓની અત્રે હાજરી છે એમ માની ને કરવાનું છે એ વીરનર સ્વર્ગવાસી થયા છે છતાં પણ અમર છે ધન્ય છે આવા નરરત્ન પેદા કરનાર જનેતાઓ ને. આવતી કાલે પ્રતીષ્ઠા કાર્ય પહેલા ખોંભડીએ હાથે આજે ઉંચા ભાઈઓ સવાર માં ગામ આગે દાતણ પાણી કરી ન્હાઈ ધોઈ આવી જશું એમ ઇચ્છું છું એ આપણે એમ માનીએ કે ખોંભડી માં સનાતન ધર્મ સનાતની નાંઈ છે તો આપણી મોટી ભૂલ છે.

અસ્તુ

સમાપ્ત   સમય- ૧૦ા વાગે રાતના.

પ્રમુખની સહી.
પટેલ-પરબત લખૂ

ખોંભડી. તા. ૧૬-૫-૪૬

સવારના ૭ા વાગાથી. ૧૨ વાગ્યા સુધી ચાલેલ.

કામ કાજ ની નોંધ.

૮:૩૦

સવાર ના ૮ા વાગે બધાજ ભાઈઓ સભા મંડપ માં આવી ગયેલ હતા. વાલીન્ટીઅરો એ જયનાદ પોકાર્યા હતા. શ્રી. પ્રમુખ સાહેબે સુચના આપી કે આપણા માંથી. કોઈ એમ ન સમજે કે અમો મેમાન તરીકે આવેલ છીએ પરંતુ અહીંના વતની સમજ ને કાર્ય કરતા રહેવું.

જાહેર સભા

સમય- ૯થી. ૧૨ સવારના.

પ્રમુખની દરખાસ્ત મુકનાર   શ્રી. મુળજીભાઈ શીવજી ખોંભડી.
ટેકો આપનાર.   શ્રી શીવજીભાઈ કાનજી   નખત્રાણા
પ્રમુખ-:   શ્રી. પરબત ભાઈ લખુ   મથલ.

પ્રમુખ—:

આજનું પ્રમુખ સ્થાન જોકે અહીંના વતની ભાઈઓ સ્વીકારવું જોઈએ છતાં પણ કોઈ તૈયાર ન હોતાં પ્રમુખ સ્થાન મને આપવામાં આવેલ છે

realpatidar.com

KJ-BK-4-34

realpatidar.com

તો હું તેનો સ્વીકાર કરી મારૂ સ્થાન લઉં છું.

શ્રી. રતનશીભાઈ ભીમજી વીશાણી.

આજે આપણને કાર્ય ઘણાં કરવાનાં છે અને સમય થોડો રહેલ છે. સભા માટે ઘણા ભાઈઓને હોંશ હશે પણ સમયના અભાવે આજે સભા થઈ શકે તેમ નથી. આપણે આપણું કાર્ય ઝડપથી કરતા જઈશું એમ ઈચ્છું છું આપણી શાતિનાં લગભગ ૨૩ મંદિરો આપણી અગાઉ થઈ ગયેલ છે. અને પાંચ ગામો રો આધારે પણ તૈયાર છે. આપણી પણ જાણ આવે છે કે આપણામાં કેટલીક જાગ્રતી આવી ગયેલી છે આ ગામમાં સનાતની ભાઈઓનાં કુલ સાતજ ઘર છે તો આપણે આપણી ફરજ સમજીને એ ભાઈઓને ત્રણ જાતની સેવા આપશું એમ ઈચ્છીએ છીએ કહેવત છે કે પંચકી લકડી એકકા બોજ તો આપણે તેઓને પુરતી સહાયતા આપશું એમ ઈચ્છું છું હવે ભગવાનને પધરાવવાનું કાર્ય કરવાનું છે તો તમો સર્વે ભાઈઓ યથા શકિત ફાળો આપશો એવી આશા રાખું છું — કાર્યક્રમ -

મંદીરનું ઈંડું ચડાવનાર.

૭૫૫) મુળજીભાઈ શીવજી વાસાણી ખોંભડી વાળા.

ધ્વજ ચડાવનાર

૨૫૫) લધાભાઈ મેઘજી ~~વીશાણી વાળા~~. રસલીઆ વાળા

મુર્તિ પધરાવનાર

૯૫૫) શ્રી. રતનશીભાઈ ભીમજી વારશાણી વાળા.
~~... વિશ્રામભાઈ રામજી ખીરસરા વાળા~~

ગણપતિ પધરાવનાર.

૨૫૫) વિશ્રામભાઈ રામજી ખીરસરા વાળા.

ભગવાનનો હાર ૧ લો.

૨૦૫) મેઘજી લખમશી વીશાણી વાળા.

" " હાર ૨ જો

૧૦૫) વાલજી ભાણજી પાડીઆ માધાપરકંપા (ગુજરાત)

" " હાર ૩ જો

૨૦૫) કાનજી વીરજી નાકરાણી. વીશાણી વાળા

લક્ષ્મીજીનો હાર ૧ લો

૨૫૫) વિશરામ રામજી નાં માતાજી પુરબાઈ ખીરસરા વાળા.

હાર ૨ જો.

૫૫) કેસરબાઈ (રતનશી ભીમજી નાં બ્હેન) વીશાણી વાળા.

realpatidar.com

KJ- BK-4-35

realpatidar.com

સ. હાર ૩ જો.

૫૧) નથુભાઈ પ્રેમજી મથલવાલા.

ભગવાનની આરતી. ૧

૨૫૧) વાલજી ભોગજી વાડીઆ માધાપરુંપા. (ગુજરાત)

આરતી. ૨ જી

૨૦૧) કાનજી વાલજી ભાવાણી મથલ (હાલે મોતીસરી ગુજરાત.)

આરતી ૩ જી

૧૫૧) રૈયા ખીમજી નાકરાણી નેત્રાવાલા (હાલે સદાતપુર)

મહાવીર ની મૂર્તિ પધરાવનાર

૨૦૧) વિશ્રામ લધા રસલીઆ.

ચમર ઢાળનાર.

૨૫૧) નાનજી હરજી વાસાણી કોટડા (જડોદર)

ભગવાનને પ્રસાદ ચડાવનાર.

૧૫૧) વાલજી ભાઈ લધુ ઉખરડા વાલા.

૪૮૬૬)

realpatidar.com